



Azadi Ka
Amrit Mahotsav
જ.નૂ./મા-૨/૨૦૨૪/ ૩૫૮૮

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,
એ/૩, જિલ્લા સેવા સંદર્ભ-૨,
અઠવાલાઈન્સ, સુરત

Web : suratdeo.org

Email : suratdeo@gmail.com

તા.૧૨/૦૩/૨૦૨૪

પ્રતિ,

આચાર્યશ્રી,

સરકારી, અનુદાનિત માધ્યમિક અને ઉત્ત્યતર માધ્યમિક શાળાઓ તરફ

જિ.સુરત

આ સાથે સામેલ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ છરાવ ક્રમાંક: ED/CEF/e-file/3/2023/5297/CHH સચિવાલય, ગાંધીનગરનો તા.૧૨/૦૩/૨૦૨૪નાં પત્ર અન્વયે તમામ શાળાઓએ
આપની કક્ષાએથી ચૂટપણે અમલ કરવા સાર્થક.


જિલ્લા શિક્ષણાધિકારી

સુરત, જિલ્લો-સુરત

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં
અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે
"નમો લક્ષ્મી યોજના"

ગુજરાત સરકાર
શિક્ષણ વિભાગ
દરાવ ફોર્માટ: ED/CEF/e-File/3/2023/5297/CHH
સચિવાલય, ગાંધીનગર
તા. ૧૨/૦૩/૨૦૨૪

પ્રસ્તાવના:

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબત સુનિશ્ચિત કરવાની ભલામણો કરેલ છે. પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓના ૧૦૦% નામાંકન અને સ્થાયીકરણ માટે અને તેમાં પણ કન્યા કેળવણીની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી થયેલ છે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસો હથ ધરવામાં આવેલ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે કિશોરવયની કન્યાઓના પોખણ અને આરોગ્યને વધુ સુન્દર બનાવવાની જરૂરીયાત જણાયેલ છે. જેથી કિશોરવયની વિદ્યાર્થીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોખણ મળે અને તેઓનું સશક્તીકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવાનું સરકારશ્રીની વિચારણા હેઠળ હતું.

દરાવ:

પ્રસ્તુત બાબતે કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અલ્યુંડસ કરતી વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવાની યોજના નીચેની શરતોને આધીન અમલમાં મૂકવાનું ઢરાવવામાં આવે છે.

૧. યોજનાનું નામ :

આ યોજનાનું નામ "નમો લક્ષ્મી યોજના" રહેશે.

૨. લાભાર્થીની પાત્રતા:

- રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને નીચે મુજબની પાત્રતાને આધીન આ સહાય મળવાપાત્ર રહેશે.

- a) રાજ્યની સરકારી અથવા અનુભાવિત પ્રાથમિક શાળાને ઘોરણ કરી ઘોરણ દમાં પ્રવેશ મેળવેલ હોય, અથવા
- b) રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રક્રિયાની ઘોરણ થી તો અભ્યાસ પૂર્ણ કરી ઘોરણ દમાં પ્રવેશ મેળવેલ હોય, અથવા
- c) ઉપર (a) અને (b) સિવાયની જે વિદ્યાર્થીનોએ ઘોરણ-૮ પૂર્ણ કર્યો બાદ ઘોરણ દમાં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાસ્થિક આવક રૂ.૫ લાખ કે તેથી ઓછી હોય.

૩. મળવાપાત્ર સહાય:

- આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીને કુલ રૂ. ૫૦,૦૦૦/- સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે.
- ઘોરણ ૮ અને ૧૦ના મળી કુલ રૂ. ૨૦,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી ૮ અને ૧૦ ઘોરણમાં શૈક્ષણિક વર્ષ દરમયાન ૧૦ માસ માટે માસિક રૂ. ૫૦૦/- મુજબ વાર્ષિક રૂ. ૫,૦૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૦,૦૦૦/- ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૦,૦૦૦/- ઘોરણ ૧૦ની બોડ પરીક્ષા પાસ કરેથી મળવાપાત્ર રહેશે.
- ઘોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી ૧૧ અને ૧૨ ઘોરણમાં શૈક્ષણિક વર્ષ દરમયાન ૧૦ માસ માટે માસિક રૂ. ૭૫૦/- મુજબ વાર્ષિક રૂ. ૭,૫૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૫,૦૦૦/- ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૫,૦૦૦/- ઘોરણ ૧૨ની બોડ પરીક્ષા પાસ કરેથી મળવાપાત્ર રહેશે.

૪. સહાયની રકમની ચુકવણીની પ્રક્રિયા:

- આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશી, શાળાઓ રહેશે.
- નિયામકશી, શાળાઓ દ્વારા આ સહાય યોજનાના સુચારુ સંચાલન માટે એક અલગ “નમો લક્ષ્યી” પોર્ટલ બનાવવાનું રહેશે.
- આ યોજના હેઠળ આર્થિક સહાયની ચુકવણી નિયામકશી, શાળાઓ દ્વારા ડાઇરેક્ટ બેનિફિટ ડ્રાન્સફર (DBT)થી વિદ્યાર્થીની માતાના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હૃત્યાત ન હોય, તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
- શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં ઘોરણ ૮ થી ૧૨માં દાખલ થયેલ વિદ્યાર્થીનોની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS (ચાઇલ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલમાં કરવાની રહેશે.

eSign
 Signed by: HITESH
 KISHORBHAI GOHIL
 Reason: Document Validation
 Location: Ahmedabad, India
 Date: 12-Mar-2024 (06:48 PM)

5. નિયામકશી, શાળાઓ દ્વારા CTS પોર્ટલ પર શાળાઓએ કરેલ વિદ્યાર્થીનીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી મારફત કરાવવાની રહેશે અને ત્યાર બાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીની યાદી નમો લક્ષ્ણી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
6. પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીનોને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જુન માસની સહાયની રકમ સંબંધિત બેન્ક ખાતામાં જુન માસમાં જ જમા કરાવવાની રહેશે અન્યથા મોડામાં મોડા જુલાઇ માસમાં જુન, જુલાઇની સહાયની રકમ એક જ સાથે સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવાની રહેશે.
7. ત્યાર બાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની ૧૦ તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થીની માત્રા અથવા વિદ્યાર્થીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
8. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ-૮ થી ૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ- ૬ થી ૧૨માં પ્રવેશ મેળવે, તો તેઓને પણ આ યોજના હેઠળ લાગે મળવાપાત્ર રહેશે. તે માટે આ વિદ્યાર્થીનોનું પાત્રતાનું ધોરણ પારા-૨માં જણાવ્યા પ્રમાણે જ રહેશે.
9. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જ્ઝર જણાય ત્યાં વિદ્યાર્થીનોની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે. જે દરમિયાન જે વિદ્યાર્થીનોની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ ૮૦% નહીં જળવાતી હોય તેવા વિદ્યાર્થીનોની સહાય બંધ કરી દેવામાં આવશે.
10. કોઈ પણ કારણસર જો કોઈ વિદ્યાર્થીની અધ્યવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સાઓમાં આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં તથા વિદ્યાર્થીને ચૂકવાયેલ સહાયની રકમ પૂરત લેવાની રહેશે નહીં.
11. રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં. જો વિદ્યાર્થીની આગળનો અભ્યાસ ચાલુ રહે તો આગળના ધોરણમાં નિયમાનુસાર સહાય મળવાપાત્ર રહેશે. વર્ષ ૨૦૨૪-૨૫ની રિપીટર વિદ્યાર્થીનોને ધોરણ-૮નો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાના આધારે આ સહાય મળવાપાત્ર રહેશે.
12. બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યેથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે, જે કિસ્સાઓમાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ને બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર રહેશે.
13. વિદ્યાર્થીના સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે.

Signed by: HITESH
 KISHORBHAI GOHIL
 Reason: Document Validation
 Location: Ahmedabad, India
 Date: 12-Mar-2024 (06:46 PM)

૬. અન્ય બાબતો:

- આ ઠરાવના ઉચિત અમલીકરણ માટે શિક્ષણ વિભાગ અથવા નિયામકશ્રી, શાળાઓ નિર્ણય કરી શકશે અને જરૂરી આનુષ્ઠાનિક સૂચનાઓ આપી શકશે.
- આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી ૪૨વાનું રહેશે.

આ ઠરાવ વિભાગની સરખાકમાંકની ઈ-ફાઈલ પર સરકારશ્રીની તા. ૧૨/૦૩/૨૦૨૪ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હૃકમથી અને તેમના નામે,

eSign
Signed by: HITESH
KISHORBHAI GOHIL
Reason: Document Verification
Location: Ahmedabad, India
Date: 12-Mar-2024 (08:45 PM)

(કિંતેશ ગોહિલ)

નાયબ સચિવ

શિક્ષણ વિભાગ

પ્રતિ,

- માન. રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી, રાજ્યભવન, ગાંધીનગર (પત્ર દ્વારા)
- માન. મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી, સ્વાણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર
- માન. મંત્રીશ્રી (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) ના અંગત સચિવશ્રી, સ્વાણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર
- માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ના અંગત સચિવશ્રી, સ્વાણિમ સંકુલ-૨, સચિવાલય, ગાંધીનગર
- મુખ્ય સચિવશ્રીના અધિક સચિવશ્રી, મુખ્ય સચિવશ્રીનું કાર્યાલય, સચિવાલય, ગાંધીનગર
- અગ્ર સચિવશ્રી (ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ), શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
- સચિવશ્રી (પ્રા.શ્ર.અને મા.શ્ર.), શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
- અધ્યક્ષશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
- નિયામકશ્રી, શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-૧૬, ગાંધીનગર
- અધ્યક્ષશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ, સેક્ટર-૨૧, ગાંધીનગર
- સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી, સેક્ટર-૧૭, ગાંધીનગર
- નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-૧૬, ગાંધીનગર

- નિયામકશ્રી, જુસીઇઆરટી, સેક્ટર-૧૨, ગાંધીનગર
- છિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ તમામ (નિયામકશ્રી, શાળાઓની કચેરી મારફતો)
- વિભાગની સર્વે શાખાઓ. આઇ.ટી. શાખા, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર (આ ઠરાવ વિભાગની વેબસાઇટ પર અપલોડ કરવા સારુ)
- નાયબ સેક્શન અધિકારી સિલેક્ટ ફાઇલ
- શાખા સિલેક્ટ ફાઇલ

ક્રમાંક: ઘ/માદ્ય./અને-૩/૨૦૨૪/૩૪૧૪-૫૨

નિયામકશ્રી શાળાઓની કચેરી,
બીજો માળ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર,
સેક્ટર-૧૬, ગુ.રા., ગાંધીનગર

તા. ૧૩/૦૩/૨૦૨૪

પ્રતિ,


છિલ્લા શિક્ષણાધિકારીશ્રી,

તમામ

વિષય:- નમો લક્ષ્મી યોજના બાબત

સંદર્ભ: શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: ED/CEF/e-file/3/2023/5297/CHH, તા. ૧૨/૦૩/૨૦૨૪

ઉપર્યુક્ત વિષય પરત્યે જણાવવાનું કે, શિક્ષણ વિભાગના સંદર્ભદર્શિત ઠરાવથી નમો લક્ષ્મી યોજના વર્ષ. ૨૦૨૪-૨૫ થી અમલ કરવા ઠરાવેલ છે. જે અન્વયે જરૂરી કાર્યવાહી અને અમલવારી માટે જાણ અથ્ય.



સાયુક્ત શિક્ષણ નિયામક
માદ્યમિક
ગુ.રા., ગાંધીનગર